





RERA CARPET AREA CAL (7TH FLOOR)



RERA CARPET AREA CALC (1ST TO 6TH FLOOR)



RERA CARPET AREA CALC (GROUND FLOOR)

BUILT UP AREA CALCULATION			
GROUND TO 6TH FLOOR			
GROUND TO 5TH FLOOR			= 322.18
LESS			
(1) $0.87 \times 15.0881 / 2 =$	3.20		
(2) $35.67 \times 4.661 / 2 =$	8.33		
(3) $0.8549 \times 8.281 / 2 =$	3.52		
(4) $0.8882 \times 7.5 =$	4.22		
(5) $2.9902 \times 5.5338 =$	1.68		18.75
NET B.A. ON GROUND TO 6TH FLOOR			= 302.41 SQ.MT.
7TH FLOOR			
75.47819.69			= 272.17
LESS			
(1) $0.8489 \times 16.41 / 2 =$	3.42		
(2) $31.11 \times 1.51 =$	2.30		
(3) $0.6847 \times 50.47 / 2 =$	2.37		
(4) $0.6882 \times 7.5 =$	1.88		
(5) $2.8942 \times 7.14238 =$	1.88		41.53
NET B.A. ON 7TH FLOOR			= 230.69 SQ.MT.
BUILT UP AREA CALCULATION			
GE. FLOOR			
B.A. ON GE. FLOOR			= 302.41
LESS			
(A) $7.596(4.19+3.51)/2+29.22 =$			
(B) $3.51(2.95 \times 8.28) =$	8.58		
(C) $11.55(3.40) =$	3.59		
(D) $24.73(9.48) =$	11.90		55.29
NET FS. AREA ON GE. FLOOR			= 243.13 SQ.MT.
1ST TO 6TH FLOOR			
B.A. ON 1ST TO 6TH FLOOR			= 302.41
LESS			
(A) $5.22(4.19+3.51)/2 =$	21.21		
(B) $2.22(4.77+4.58)/2 =$	10.38		
(C) $5.51(2.95) =$	5.59		40.17
NET FS. AREA ON 1ST TO 6TH FLOOR			= 282.24 SQ.MT.
7TH FLOOR			
B.A. ON 7TH FLOOR			= 230.69
LESS			
(A) $5.22(4.19+3.51)/2 =$	21.21		
(B) $2.22(4.77+4.58)/2 =$	10.38		
(C) $5.51(2.95) =$	5.59		60.17
NET FS. AREA ON 7TH FLOOR			= 196.47 SQ.MT.

FLOOR PLAN (GR. TO 7TH FLOOR PLAN)		2 / 3
PLAN SHOWING PROPOSED COMMERCIAL BUILDING ON S.P. NO: [S.P. 120/P+121/P+124/P] OF F.P. NO-315/PAIKI (i.e. C.S. NO.: 5924+5927+5928) = S.P. NO: [S.P. 119+120/P+121/P+124/P] (i.e. F.P. NO-381/4) OF F.P. NO: 381/4, OF T.P.S. NO: 26 - VASNA NORTH SECOND VARIED DRAFT SUB. TO GOVT. [R.S. NO: 379+380+379/PAIKI, (O.P. NO: 196) OF FINAL SANC. T.P.S. AND R.S. NO: 379+380+379/PAIKI, S.P. NO: 119, 120/P, 121/P AND 124/P (O.P. NO: 381/2/P/PAIKI) OF 2ND VARIED DRAFT TPS OF MOJE, VASNA, TAL.: SABARMATI, DIST: AHMEDABAD] / [CITY SURVEY NO: 5924, 5927, 5928 (OF F.P. NO: 315/PAIKI) OF SHEET NO: 51, OF CITY SURVEY AREA, AHMEDABAD-T.P.S. NO.26, VASNA]		
SCALE - 1 : 100		
ZONE AS PER RDP-2021 : RESIDENTIAL-1 (ORE) R-1		
USE OF CONSTRUCTION : COMMERCIAL (SHOPS)		
<i>હાલે કોલર નો નીચે સુધારેલો દર્શાવેલ છે અને 4, 5 ના સુધારેલો નીચે 6 ના સુધારેલો નીચે રાઈલ નો નીચે સુધારેલો નીચે 6 ના સુધારેલો નીચે નીચે સુધારેલો</i>		
		
SCHEDULE OF OPENING		RCC STAIR DETAIL
DOOR	WINDOWS	VENT
D1=0.90X2.10	W1=3.60X1.20	V=0.60X0.60
D2=0.75X2.10	W1=2.40X1.20	
RS=3.50X2.10		
		WIDTH=1.50M TREAD=0.30M RISE=0.16M
COPAL N. JAISWAL (Grade-I) Gt. Rajmaji Dhammaram Society, C/o. C.M.C. Factory, Odhar Road, Ahmedabad-382415. LIC No: AMW-CW-6529169722/F1		COLOUR NOTE -
		 PROPOSED WORK PROPOSED DRAINAGE
CLERK OF WORKS <i>[Signature]</i> Gurpreet Singh Khosla S.E. (Regd) 4/99, Durgamchand, Badliwala P.O. (N.C. 00400-305013, AND GING (C.No. ER 0774171220R,		JAYEN B. SHAJEE 2, Marol Nagar, N.C. 00400-305013, (Regd) P.O. Badliwala, P.O. (N.C. 00400-305013, Durgamchand, Badliwala P.O. (N.C. 00400-305013, AND GING (C.No. ER 0774171220R,
ENGINEER <i>[Signature]</i>		STRUCTURAL ENGINEER <i>[Signature]</i>
For, Sarveshanti Properties Pvt. Ltd. <i>[Signature]</i> Authorized Signatory		SARVESHANTI PROPERTIES PVT. LTD., DIRECTOR: ANAM S. TEJARI DEVELOPER (LIC. NO: DEY1219D1321 4/11A, SUDH VINAYAK TOWER, B.H. DEPT OFFICE: MAHARAJA, AHMEDABAD-380015. DEVELOPER

[illegible]

